

ખાતાનું નામ : લાઈટ

પ્રતિ,  
જાહેર માહિતી અધિકારી અને એસેસર અને ટેક્સ કલેક્ટરશ્રી,  
આર.ટી.આઈ. સેલ વિભાગ  
સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટીવ ડીસ્કલોઝર  
(વર્ષ ૨૦૨૦-૨૧) ની માહિતી બાબત....

શ્રીમાન,

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ ખાતાની વર્ષ ૨૦૨૦-૨૧ માટે જાહેર  
માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર કરવામાં આવેલ છે, જે  
આ સાથે સામેલ છે, તો સદરહું માહિતીને જાહેર માહિતી અધિનિયમ હેઠળ આગળની આનુષ્ઠાનિક  
કાર્યવાહી થઈ આવવા રખાવી લેવા વિનંતી સહ.

ઓ. એસ.

આસી. મેનેજર

(લાઈટ)


એડી. ચીફ એન્ઝ્યુનિયર

(લાઈટ)

(વર્ષ : ૨૦૨૦-૨૧)

# અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ

## સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ



**માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫**  
**કલમ નંબર ૪ (૧) અન્વયે**  
**પ્રો-એક્ટીવ ડીસ્કલોગ્રાર**  
**(લાઇટ વિભાગ)**

---

લાઇટ ખાતું, “સી” -૪૬૦૫, ૫ મો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ -૩૮૦ ૦૦૧  
ફોન નંબર : ૦૨૪૨૦૮૨૩

(૧) વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો :-


લાઈટ વિભાગનાં ટેકનીકલ વિભાગ તથા વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ વિભાગ દ્વારા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઓફિસ બીલીંગ, હોસ્પિટલ, સ્મશાનગૃહ, સ્વીમીંગ પુલ, પબ્લિક ગાર્ડન અને સ્કુલ બીલીંગના ઇલેક્ટ્રીફિકેશન, એરકન્ડીશનીંગ, વોટર કુલર, વોટર પંખીંગ સ્ટેશન, સ્વીમીંગ પુલ ફીલ્ટરેશન પ્લાન્ટ, સ્મશાનગૃહોમાં સીએનજી બઢીઓ, લીફ્ટ વગેરેની કેપીટલના SITC તથા તેના ઓપરેશન મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ ખાતાનાં વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે વર્ગ ૧ થી ૪ સુધીના અધિકારી તથા કર્મચારીઓનાં પગાર, તેઓના સર્વિસ બુક સંબંધીત તેમજ તેઓની નિવૃત્તિ, સૈ.નિવૃત્તિ, અવસાન, રીમુવ, અનફીટ થયા બાદ કર્મચારીઓને મળવાપત્ર લાભો ચુકવવાની કામગીરી જેવા વિવિધ કાર્યો તથા કાર્યલક્ષી સંબંધીત રેકૉર્ડ નીભાવણી અને તેને લગતી આનુષ્ઠાંગીક કામગીરી તથા ટેકનીકલ વિભાગ દ્વારા કરવામાં આવનાર કામોનું સક્ષમ સત્તાની મંજુરી મુજબ બજેટ બુકીંગ તેમજ સક્ષમ સત્તાની મંજુરી મુજબ કોન્ટ્રાક્ટરનાં બીલનાં પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે.

ક્રમ	અધિકારીનું નામ	હોંડો	સંપર્ક નંબર
૧	શ્રી મહેન્દ્ર કે. નિનામા	એડી. ચીફ એન્જનીયર અને અપીલ અધિકારીશ્રી (લાઈટ)	<b>M -૮૩૭૪૫૧૪૩૮૧</b> <b>O -૦૭૯૨૫૩૮૧૮૯૧</b>
૨	શ્રી એ.એ.મલ	ડે. સીટી એન્જનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૨)	<b>M -૮૩૭૬૦૧૭૫૬૫</b> <b>O -૦૭૯૨૫૩૮૧૮૯૧</b>
૩	શ્રી દિંવીજ્યસિંહ ગઢવી	ડે. સીટી એન્જનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૪)	<b>M -૮૩૨૭૦૩૮૭૭૮</b> <b>O -૦૭૯૨૫૩૮૧૮૯૧</b>
૪	શ્રી ઓગસ્ટીન મેકવાન	આસી. મેનેજર અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટ)	<b>M -૮૩૨૮૮૮૮૮૨૮૫</b>

# Organization Chart – Light Department



(૨) અધિકારીઓ અને કર્મચારીઓનાં કાર્યો તથા ફરજો :

ક્રમ	જગાનું નામ	અધિકારી/કર્મચારી પાસેથી લેવામાં આવતી કામગીરી
૧	એડી. ચીફ એન્જિનીયર (લાઈટ)	વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજોમાં જણાવ્યા મુજબ દરેક વિભાગની વિઝિટ કરવી. ઓ એન્ડ એમ નો કોન્ટ્રાક્ટરમાં ટેન્ડર મુજબ મુજબ સ્ટાફ તથા કામગીરી થાય તે મુજબ ધ્યાન રાખવું. ઓઝેન્ટેશન કરવાની જરૂરીયાત છે કે કેમ તેની ટેકનીકલ ચકાસણી કરી ઓઝ્ય વહીવટી કામગીરી કરવી. કેપીટલ કામ તથા રેવન્યુ કામના ટેન્ડર સમયસર કરવા. એક્સ્ટ્રા આઇટમ થતી હોઈ તો તેની ચકાસણી, અન્ય વિકલ્પ, સક્રમ સત્તાની મંજુરીની કામગીરી. એનજી એફીશીયન્સીને લગતી કામગીરી. પાવર ફેક્ટર ઈમ્પ્રોવેન્ટ સ્ટાફની વ્યવસ્થા. બજેટને લગતી કામગીરી. પ્રોજેક્ટનું મોનીટરીગ સમયસર પૂર્ણ થાય તે અંગે કામગીરી, કવોલીટી તથા મેઝરમેન્ટની ચકાસણી. ઈલે. મીકે. સ્પેર્સ, સબ પંપની વધારાની સ્પેર વ્યવસ્થા રાખવી. હસ્તક ડેટાના સ્ટાફની કામગીરી પર દેખરેખ અને પરફોર્મન્સ ઈવેલ્યુઅશન આરટીઆઈ, એમપી-એમએલએ ના પ્રક્રણના સમયસર જવાબ કરવા વિભાગની વહીવટી કામગીરી
૨	ડે. સીટી ઈજનેર	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઈલે. મીકે. ઈક્વીપમેન્ટ બંધના રહે તેનું ધ્યાન રાખવું તથા ઈલે. મીકે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીગ કરાવવું. કલોરીનેશન ખાના (વક્ફ/સ્પેર) ચાલુ કંડીશનમાં રાખવા તથા કલોરીનેશનયુક્ત પાણી જ સપ્લાય થાય તે સુનિશ્ચિત કરવું. મ્યુનિસિપલ સ્નાનાગારમાં પાણીની શુદ્ધતા અંગે ધ્યાન રાખવું. પ્રીવેન્ટીલ મેઈન્ટેનાન્સ સમયસર થાય તેનું ખાનીગ કરવું. ઓ એન્ડ એમ કોન્ટ્રાક્ટર રીપેરીગના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટ્ર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહીં તેનું ચેકીગ કરવું. પ્રોજેક્ટના કામના ઓઝેન્ટેશનના કેપીટલ કામોના, રેવન્યુ કામોના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર સ્પેસીઝિકેશન મુજબ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું, પાવર પ્રોક્યોરમેન્ટની સમયબદ્ધ કામગીરી કરવી. કેપીટલ તેમજ રેવન્યુ કામોની એમ.બી. રેકોડીગ, મેઝરમેન્ટ તથા કવોલીટી ચકાસણીની કામગીરી.,
૩	આસી.સીટી ઈજનેર	

		<p>પાવર ફેક્ટર ઈમ્પ્યુવમેન્ટની કામગીરી.</p> <p>એનજર્ઝીલાનું દર માસે સ્કુટીની કરવું તથા એનજર્ઝ વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકિદે પગલાં લેવાં.</p> <p>જોનલ એક્ટીવીટી, હાલ્સ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એએમસી મેટ, સોલર, ઈવેન્ટ્સ સ્પેશીયલ, એસઆરએફ્ડીસીએલ તથા વરસાદની તુતુમાં અન્ડરપાસમાં પાણી ભરાય તો તે માટે નિકાલની કામગીરી સેન્ટ્રા મારફતે કરાવવી.</p>
૪	આસી. ઈજનેર	<p>કોઈપણ ઈલે.-મીડે. ઈક્વીપમેન્ટ બંધના રહે તેનું ધ્યાન રાખવું.</p> <p>ઇલે.મીડે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું.</p> <p>ગ્રીવેન્ટીંગ મેઈન્ટેનન્સ સમયસર થાય તેનું ખાલીનીગ કરવું.</p> <p>કોન્ટ્રાક્ટ ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહીં તેનું ચેકીંગ કરવું.</p> <p>ટેન્ડરમાં કેપીટલ/રેવન્યુ કામના એમ.બી. રેકોડીંગ કરવું તેમજ મેજરમેન્ટ ચેક કરવું.</p> <p>પ્રોજેક્ટ/ઓળખના કામમાં ઈરેક્ષન સમયે ટેકનીકલ ચકાસણી કરવી.</p> <p>સ્ટાફ સંબંધી વહીવટી કામગીરી કરવી.</p> <p>એનજર્ઝ એફ્ઝીશીયન્સીને લગતી કામગીરી.</p> <p>એનજર્ઝ બીલાનું દર માસે સ્કુટીની કરવું તથા એનજર્ઝ વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકિદે પગલાં લેવાં.</p> <p>જોનલ એક્ટીવીટી, હાલ્સ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એએમસી મેટ, સોલર, ઈવેન્ટ્સ સ્પેશીયલ, એસઆરએફ્ડીસીએલની કામગીરી</p>
૫	ટેક.સુપરવાઈઝર	લેખીત રીપોર્ટ એ.ઈ./એ.સી.ઈ.ને દરરોજ આપવા, ડાયરી મેઈન્ટેઇન કરવી, કોઈપણ પ્રોબ્લેમ હોય તો એ.ઈ./એ.સી.ઈ. અથવા ટે.સી.ઈ.ને જાણ કરવી. દરેક જગ્યાની રેગ્યુલર સ્થળતપાસ કરવી તથા તેનો રીપોર્ટ ઉપરી અધિકારીને સબમીટ કરવો.
૬	લીફ્ટમેન	સમયસર લીફ્ટ ચલાવવાની કામગીરી.
૭	ઇલેક્ટ્રીશીયન	ઓવરઓલ એસઆરએફ્ડીસીએલ, પ્રોજેક્ટ મોસ્ટ ઓફ આઈએમપી પ્લેસીસ, મેન્ટેનન્સ ઓફિસ બીલ્ડીંગસની કામગીરી
૮	ટેલી. ઓપરેટર	બહારથી આવતા તથા અંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુષ્ઠાંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા
૯	રીસે.કમ ટેલી.ઓપરેટર	બહારથી આવતા તથા અંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુષ્ઠાંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા
૧૦	આસી. મેનેજર	જુદા જુદા ખાતાઓની વહેચણી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વહીવટી કાર્ય આનુષ્ઠાંગીક તમામ વહીવટી કામગીરી

૧૧	ઓફિસ સુપ્રીટેન્ટ	આસી.મેનેજરશ્રીની સુચના અનુસાર તમામ કામગીરી
૧૨	એકાઉન્ટન્ટ	ખાતાની નાણાંકીય તમામ કામગીરીનું સંચાલન
૧૩	હેડ કલાર્ક	ઓફિસ સુપ્રી.ની સુચના અનુસાર વહીવટી કામગીરી
૧૪	સીની. કલાર્ક	જુદા જુદા ખાતાઓની વહેચળી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વિષયોની કામગીરી, ઈભેશ કેશ, પાર્ટી પેમેન્ટની તમામ કામગીરી, ઈએમરી, પેમેન્ટ પહોંચ, સ્ટ્રીટલાઈટના બીલોને લગતી તમામ કામગીરી
૧૫	જુની. કલાર્ક	બજેટ બુક, ટરાવ, બીલ કલાર્ક, રીએમ્બર્સમેન્ટ, સર્વિસ બુક મેઇન્ટેનાન્સ, કર્મચારી/અધિકારી નિવૃત્તિ તથા સ્વ.નિવૃત્તિની કામગીરી, પોસ્ટેજ, આઈટવર્ડ-ઇનવર્ડ ની કામગીરી.
૧૬	પટાવાળા	ઇનડોર પટાવાળા - ખાતાકીય પટાવાળા તરીકેની કામગીરી આઉટડોર પટાવાળા - બહારના ખાતાને લગતી ટપાલો આપવા જવાની કામગીરી, તથા ખાતાકીય પત્રો પોસ્ટેજની કામગીરી
૧૭	જુની. ચાર્જમેન	મશીનરીની મિકેનીકલ ઇક્વીપમેન્ટને પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરાવવી તથા મિકેનીકલ ગોંગ સાથે તેમજ ફીટર, ટર્નર, ગોંગમજૂર વિગેરેને મિકેનીકલ માર્ગદર્શન કરી તેઓ સાથે કો-ઓર્ડિનેશન કરી કામગીરી કરાવવી.
૧૮	પંપ અને વાયરમેન એટેડન્ટ	પંપને લગતી કામગીરી.
૧૯	વાયરમેન	ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટ તેમજ સંસ્થાના અન્ય વિભાગો વિગેરે રૂમોની લાઈટિંગ તથા જરૂરી વાયરીંગ કરવાની કામગીરી તથા ઇલેક્ટ્રીશીયનની સાથે ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરવી.
૨૦	ફીટર	સેન્ટ્રીફ્યુગલ પંપ મોટર સેટ તથા મિકેનીકલ મશીનરીનાં પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કરવાની કામગીરી તેમજ આસી.ફીટરને મિકેનીકલ માર્ગદર્શન કરી કામગીરી કરાવવી.
૨૧	પંપમેન	પંપીંગ સ્ટેશનમાં આવેલ પંપો ચાલુ બંધ કરવાની કામગીરી
૨૨	વાયરમેન હેલ્પર	ઇલેક્ટ્રીશીયન અને/અથવા વાયરમેન સાથે સંસ્થાના અન્ય વિભાગની તમામ ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટનાં ઓપરેશનની કામગીરી તેઓની સાથે રહી કરવી.
૨૩	ફીટર હેલ્પર	મીકે. કામમાં ફીટરને જરૂરી હેલ્પ કરવાની કામગીરી
૨૪	ગોંગ મજૂર	તમામ ખાતાની ઇલેક્ટ્રીકલ, મિકેનીકલ મશીનરી તથા કલોરીન મશીનરીની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કામગીરી કરવાની ગોંગની સાથે રહી સુચના મુજબની મજૂરીની કામગીરી.

- (૩) દેખરેખ અને જવાબદારનાં માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસારની માહિતી :  
ખાતાની કામગીરીનાં અનુસંધાને જે તે સક્ષમ સત્તાની મંજુરી મેળવીને નિર્ણય લેવામાં આવે છે.
- (૪) પોતાનાં કાર્યો બજાવવા માટે નક્કી કરેલાં ધોરણો :  
જે તે કામગીરી માટે સક્ષમ સત્તાની જરૂરી મંજુરી મુજબ તુમાર અને ફાઈલોનો નિકાલ કરવામાં આવે છે.
- (૫) પોતાનાં કાર્યો બજાવવા માટે પોતાની પાસેનાં અથવા પોતાનાં નિયંત્રણ હેઠળનાં અથવા પોતાનાં કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ્સ :  
અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરિશનનાં નીતિ-નિયમો તથા બોઝે પ્રોવિન્સીયલ ભૂનિસિપલ એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.
- (૬) પોતાની પાસે અથવા પોતાનાં નિયંત્રણ હેઠળ હોય તેવાં દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક :  
લાઈટ ખાતાનાં વર્ગ-૩ અને વર્ગ-૪ માં જુદા જુદા હોદ્દા હેઠળનાં કેટેગરી વાઈજ કર્મચારીઓ/અધિકારીઓની સર્વિસબુક, પગારનાં પત્રકો તથા તેને લગતાં આનુષાંગિક રેકર્ડ નિભાવવામાં આવે છે.
- (૭) તેની નીતિ અથવા તેનાં અમલીકરણનાં ઘડતર સંબંધમાં જનતાનાં સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાન ગોઠવણીની વિગતો :  
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૮) તેનાં ભાગ તરીકે અથવા તેની સલાહમાં હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓનાં બનેલાં બોર્ડ કાઉન્સીલો, સમિતિઓ અને બીજાં મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :  
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૯) તેનાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તકા :  
અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરિશન મારફતે દર વર્ષે બહાર પાડવામાં આવતી ડાયરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત સદર ડાયરીની સોફ્ટકોપી      અમદાવાદ      ભૂનિસિપલ      કોર્પોરિશનની      વેબસાઈટ [www.ahmedabadcity.org](http://www.ahmedabadcity.org) પર મુકવામાં આવે છે. જેમાં દર વર્ષે અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરિશન દ્વારા બહાર પાડવામાં આવતી ડાયરીમાં અગત્યનાં ટેલીફોન નંબરોનો સમાવેશ કરવામાં આવે છે.

(૧૦) તેનાં વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેનાં દરેક અધિકારીઓ અને મળતાં માસિક વળતર :

ક્રમ	હોદ્દો	પે મેટ્રીક્સ
૧	એડી. સી. ઈ.	૧૧૮૫૦૦-૨૧૪૧૦૦
૨	ડી.સી.ઇ.	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૩	આ.સી.ઇ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૪	આસી.ઇજનેર	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૫	ટેક.સુપરવાઈઝર	૨૮૨૦૦-૬૨૩૦૦
૬	લીફ્ટમેન	૧૮૬૦૦-૬૩૨૦૦
૭	ઇલેક્ટ્રીશયન	૨૫૪૦૦-૮૧૧૦૦
૮	ટેલી. ઓપરેટર	૨૫૪૦૦-૮૧૧૦૦
૯	રીસે.ક્રમ ટેલી.ઓપરેટર	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૦	આસી. મેનેજર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૧૧	ઓફિસ સુપ્રીટેન્ટ	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૧૨	એકાઉન્ટન્ટ	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૩	છેડ ક્લાર્ક	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૪	સીની. ક્લાર્ક	૨૫૪૦૦-૮૧૧૦૦
૧૫	જુની. ક્લાર્ક	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૬	પટાવણા	૧૪૮૦૦-૪૭૧૦૦
૧૭	જુની. ચાર્જમેન	૨૫૪૦૦-૮૧૧૦૦
૧૮	પંપ અને વાયરમેન એટેન્ટ	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૯	વાયરમેન	૧૮૬૦૦-૬૩૨૦૦
૨૦	ફીટર	૧૮૬૦૦-૬૩૨૦૦
૨૧	પંપમેન	૧૫૭૦૦-૫૦૦૦૦
૨૨	વાયરમેન હેલ્પર	૧૫૭૦૦-૫૦૦૦૦
૨૩	ફીટર હેલ્પર	૧૫૭૦૦-૫૦૦૦૦
૨૪	ગેંગ મજૂર	૧૪૮૦૦-૪૭૧૦૦

(૧૧) તમામ યોજનાઓ સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરનાં અહેવાલોની વિગતો દર્શાવતું અંદાજપત્ર :

સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ  
[www.ahmedabadcity.org](http://www.ahmedabadcity.org) અને વર્ષ ૨૦૨૦-૨૧ નાં અંદાજપત્રમાં મુકવામાં આવેલ છે.

(૧૨) ફાળવેલ રકમ અને એવા કાર્યક્રમોનાં લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૩) આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :  
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૪) ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો :

સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ  
[www.ahmedabadcity.org](http://www.ahmedabadcity.org) અતેના ખાતાને લગતી માહિતી, અગત્યનાં ટેલીફોન નંબરો તથા વર્ષ ૨૦૨૦-૨૧ નાં અંદાજપત્ર તથા બીજી અગત્યની માહિતી ઉપલબ્ધ છે.

(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવમાં આવતાં હોય તેવા ગ્રંથપાલ અથવા તેનાં વાંચનાલયનાં કામકાજનાં કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :  
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદાઓ અને બીજી વિગતો :

ક્રમ	અધિકારીનું નામ અને હોદ્દો	ફરજનો સમય	ફરજનું સ્થળ	સંપર્ક નંબર
૧	શ્રી મહેન્દ્ર કે. નિનામા એડી. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી(લાઇટ)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૮૭૪૫૧૪૩૮૧ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૨	શ્રી એ. એ. મલ ઝે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ-૨)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૮૭૬૦૧૭૫૬૫ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૩	શ્રી હિંગીજયસિંહ ગઢવી ઝે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ-૪)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૮૨૭૦૩૮૭૭૮ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૪	શ્રી ઓગણીન મેકવાન આસ્ટી. મેનેજર અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટી બાબત)	સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી	“બી”-બ્લોક, ચોથો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M - ૯૮૨૮૩૮૮૮૨૮૫

(૧૭) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :

નથી.

## એનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગનાં તા. ૧-૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક-પોઅન્ને-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઈસેલનું બિડાશ)

### પ્રમાણપત્ર

આથી પ્રમાણ પત્ર આપવામાં આવે છે કે લાઇટ વિભાગના જાહેર સત્તામંડળ દ્વારા માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪ (૧) (ખ) અંતર્ગત સ્વચંમ જાહેર કરવાની બાબતો - પ્રોએક્ટીવ ડીસ્કલોગર (પીએડી) તૈયાર કરવામાં આવેલ છે.

જે તા.૦૧.૦૫.૨૦૨૦ ની સ્થિતીએ અધ્યયતન કરવામાં આવેલ છે. જેનું અમારા દ્વારા ઈન્સપેક્શન કમ ઓડિટ કરવામાં આવેલ છે અને જે બાબતે અપુરતી વિગતો જણાએ હતી તેની પુર્તતા કરાવવામાં આવેલ છે.

**એડી. ચીફ એન્જીનીયર  
(લાઇટ)**

**મુખ્ય મથક - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,**  
સરદાર પટેલ ભવન, સી-લોક, પાંચમો માળ,  
દાણાપીઠ, ખમાસા રોડ, અમદાવાદ

**કચેરીનું નામ -લાઇટ ખાતું**

પ્રતિ,  
ડૉ. મ્યુનિસિપલ કમિશનરશી,  
(લાઈટ ડિપાર્ટ.)

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર  
(વર્ષ ૨૦૨૦-૨૧) ની માહિતી બાબત....

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ ખાતાની વર્ષ ૨૦૨૦-૨૧ માટે જાહેર  
માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે  
સામેલ છે, તો સદરહું માહિતી પ્રોએક્ટિવ ડિસ્કલોઝર તરીકે સંસ્થાની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવાની હોઈ  
આપ સાહેબશ્રીની મંજુરી થઈ આવવા વિનંતી છે.

ઓ. એસ.

આસી. મેનેજર  
(લાઈટ/વો. ઓ.)

એડી. ચીફ એન્જનીયર  
(લાઈટ)

ડૉ. મ્યુનિ. કમિશનર  
(લાઈટ)